



COVID-19 પેનડેમિક (રોગચાળા) દરમિયાન બ્રેમ્પટનમાં ઈસ્ટર વીકએન્ડ 2020

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (એપ્રિલ 8, 2020) – આ વર્ષે, ગુડ ફ્રાઈડે શુક્રવાર, એપ્રિલ 10 નાં રોજ આવશે અને ઈસ્ટર મન્ડે સોમવાર, એપ્રિલ 13 નાં રોજ આવશે.

પીલ પબ્લિક હેલ્થના માર્ગદર્શન પ્રમાણે અને આપણાં રહેવાસીઓ અને કર્મચારીઓની સુરક્ષા માટે, સીટી હોલ અને સીટી ઓફ બ્રેમ્પટનની અન્ય બંધી સગવડો, જેમાં રિક્રિએશન અને કમ્યુનિટી સેન્ટર્સ અને લાઈબ્રેરીની શાખાઓ સામેલ છે, આગળ સૂચના આપવામાં આવે નહિ ત્યાં સુધી બંધ રહેશે જેથી COVID-19 નો ફેલાવો રોકવામાં મદદ મળી શકે.

અગ્નિશમન અને કટોકટીની સેવાઓ, ટ્રાફિક સેવાઓ, કાયદાકીય અમલ બજાવણી, રોડ ઓપરેશન્સ, POA કોર્ટ્સ અને સુરક્ષા સેવાઓ સહિતની તમામ નિર્ણાયક સેવાઓનું સંચાલન આપણાં સમુદાયને સહાયરૂપ થવા રાખેતા મુજબ ચાલુ રહેશે.

રહેવાસીઓ કોઈ પૂછપરછો માટે 311 અથવા 905.874.2000 (બ્રેમ્પટન બહારથી) નંબર પર ફોન કોલ કરી શકે છે, Brampton 311 એપનો ઉપયોગ કરી શકે છે (App Store અથવા Google Play પર ઉપલબ્ધ) અથવા 311@brampton.ca ઈમેઈલ સરનામે ઈમેઈલ મોકલી શકે છે. ટેક્સ ડિફરન્સ (કર મોકૂફ), વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવું અને પાર્ક્સ અને સગવડો બંધ થવા જેવી COVID-19 ને સંબંધિત પૂછપરછો સહિત, સીટી ઓફ બ્રેમ્પટન કે રીજીયન ઓફ પીલની કોઈપણ બાબતો માટે અમે 24/7 ઉપલબ્ધ હોઈએ છીએ. વધુ માહિતી મેળવવા વેબસાઈટ www.brampton.ca/covid19 જુઓ.

COVID-19 સુરક્ષા ઉપાયો

COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં ઘરની બહાર સુરક્ષિત રહેવા આપણાં સમુદાયે ધ્યાનમાં લેવા જેવા જરૂરી મહત્વના નિયમો અને નિયમનો અમલમાં છે.

- પીલ પબ્લિક હેલ્થ દૃઢપણે ભલામણ કરે છે કે રહેવાસીઓ માત્ર એકલા કસરત કરવા કે આવશ્યક જરૂરિયાતો માટે જ ઘરની બહાર નિકળે.
- બ્રેમ્પટનમાં 500+ ઉપરાંત તમામ પાર્ક્સ, શહેરની સગવડોમાં રમતના મેદાનો અને પાર્ક્સમાં અન્ય માળખાઓ (સ્ટ્રક્ચર્સ), લીશ-ફી ડોગ પાર્ક્સ, પિકનિક શેલ્ટર્સ (ઉજાણી સ્થાનો), આઉટડોર રમતગમતની સગવડો અને આઉટડોર ફિટનેસ ઇક્વિપમેન્ટ્સ (સ્પોર્ટ્સ ફિલ્ડ્સ, બાસ્કેટ બૉલ અને ટેનિસ કોર્ટ્સ), રિક્રિએશન સેન્ટર્સ અને આસપાસની જમીનો, અને પાર્કિંગ લોટ્સ જાહેર જનતા માટે આગળ સૂચના આપવામાં આવે નહિ ત્યાં સુધી બંધ કરવામાં આવ્યા છે. રહેવાસીઓને નોન-કમ્પ્લાયન્સ (બિન-અનુપાલન) નોંધાવવા 905.874.2111 નંબર પર કોલ કરવાનું કહેવામાં આવ્યું છે.
- આ સમયે ટ્રેઈલ્સ (પગદંડીઓ) ખુલ્લી હોવા છતાં, લોકોએ બંધાં સમયે અન્ય વ્યક્તિથી (તમારા ઘરમાં ન રહેતી વ્યક્તિથી) 2.0 મીટર દૂર અચૂક રહેવું. ટ્રેઈલ્સનો નકશો જોવા, [અહીં](#) ક્લિક કરો.
- પાંચ કે વધારે વ્યક્તિઓ એકઠા થવાનું ટાળો – આ હવે પ્રોવિન્સે અમલી બનાવેલા ઈમરજન્સી મેનેજમેન્ટ એન્ડ સિવિલ પ્રોટેક્શન એક્ટ હેઠળ પ્રતિબંધિત છે.
- કૃપા કરી વાપરેલા ફેસ માર્ક્સ, પ્રોટેક્ટિવ ગ્લોવ્સ અને અન્ય ઘરેલું આરોગ્ય સંભાળ ક્યારને એક થેલીમાં મૂકીને ક્યારમાં તેનો નિકાલ કરીને તે ફેંકી દો.



- બ્રેમ્પટન COVID-19 ઈમરજન્સી પગલાઓના પેટાકાનૂન (બાય-લો) હેઠળ દંડ હવે અમલમાં આવ્યો છે. વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર રાખવાના પગલાઓ ન અનુસરવા બદલ દરેક ગુના માટે વ્યક્તિઓને લઘુત્તમ \$500 અને મહત્તમ \$100,000 સુધીનો દંડ કરી શકાય છે. રહેવાસીઓને બિન-અનુપાલન નોંધાવવા 311 નંબર પર કોલ કરવાનું કહેવામાં આવ્યું છે.
- અમે આપણાં સમુદાય પર COVID-19 નાં પ્રભાવોથી જ્ઞાત છીએ અને કેટલાક લોકો માટે આ સમય ખાસ કરીને મુશ્કેલભર્યો અને તણાવભર્યો છે. અમે સમુદાયને સહાયરૂપ થવા વિશેષ ટાસ્ક ફોર્સ (કર્તવ્ય એકમ) શરૂ કર્યું છે. આમાં આર્થિક સહાયતા, વડીલ સહાયતા, જુવાન સહાયતા અને સૌથી નાજુક લોકો માટે સહાયતા સામેલ છે. આ ટાસ્ક ફોર્સ સંબંધિત અને તેઓ સાથે કેવી રીતે સંપર્ક કરવો તેને લગતી વધુ માહિતી વેબસાઇટ www.brampton.ca/covid19 પર ઉપલબ્ધ છે.

COVID-19 ટાસ્ક ફોર્સ (કર્તવ્ય એકમો)

COVID-19 વડીલ સહાયતા ટાસ્ક ફોર્સ: વડીલો માટે અનાજ-કરિયાણું કે દવાઓની સહાયતા માટે, 311 નંબર પર કોલ કરો અથવા covid19seniors@brampton.ca ને ઈમેઇલ મોકલો. લાંબી અઠવાડિક રજાઓ હોવાને લીધે સ્ટોરનો કામકાજનો સમય બદલાયેલો હોઈ શકે. આગામી ટેલી ટાઉન હોલ્સ માટે નોંધણી કરાવવા અથવા સંપર્કમાં રહેવા 311 નંબર પર કોલ કરો અથવા covid19seniors@brampton.ca ને ઈમેઇલ મોકલો.

COVID-19 સામાજિક સહાયતા ટાસ્ક ફોર્સ: સ્થાનિક ફૂડ બેંક્સને (અન્ન સપ્લાવતને) તાર્કિક દાનની જરૂરિયાત છે. જરૂરી ચીજવસ્તુઓ અને તે ક્યાં છોડવી તેને લગતી યાદી [અહીં](#) જુઓ. જો તમે અને તમારા પ્રિયજનને ખાદ્ય પદાર્થોની જરૂર હોય તો, કૃપા કરી [સામાજિક સહાયતા ઓનલાઇન ફોર્મ](#) ભરો. આ ટાસ્ક ફોર્સ રહેવાસીઓની જરૂરિયાતોને પહોંચી વળવા લંગર અન્ન સપ્લાવતો (એન્કર ફૂડ બેંક્સ) સાથે કામ કરી રહ્યાં છે. જો તમે ફોનથી સહાયતાની વિનંતી કરવાનું પસંદ કરો તો, કૃપા કરી 311 નંબર પર કોલ કરો. સમુદાય આધારિત સંસાધનની યાદી સહિત વધુ સંસાધનો માટે, [અહીં ક્લિક કરો](#). સંપર્કમાં રહેવા 311 નંબર પર કોલ કરો અથવા covid19support@brampton.ca ને ઈમેઇલ મોકલો.

COVID-19 જુવાન સહાયતા ટાસ્ક ફોર્સ: બ્રેમ્પટનના જુવાનો પર COVID-19 કેવી રીતે પ્રભાવ પાડી રહ્યું છે તેની ચર્ચા કરવા તેઓને Instagram પર મેયર પેટ્રિક બ્રાઉન અને COVID-19 જુવાન સહાયતા ટાસ્ક ફોર્સના સહ-પ્રમુખો, કાઉન્સિલરો ચાર્માઇન વિલિયમ્સ (Charmaine Williams) અને હરકિરત સિંહ (Harkirat Singh) સાથે લાઇવ ચેટ કરવાનું આમંત્રણ આપવામાં આવે છે. મેયર બ્રાઉનની Instagram પ્રોફાઇલ (@patrickbrownont) મારફતે શનિવાર, એપ્રિલ 11 નાં રોજ બપોરે 1 વાગ્યે લાઇવ ચેટમાં જોડાઈ શકો છો. સંપર્કમાં રહેવા 311 નંબર પર કોલ કરો અથવા covid19youth@brampton.ca ને ઈમેઇલ મોકલો.

COVID-19 આર્થિક સહાયતા ટાસ્ક ફોર્સ: આ ટાસ્ક ફોર્સ COVID-19 નાં આર્થિક પ્રભાવોને પહોંચી વળવા બ્રેમ્પટનમાં ધંધાઓને સહાયતા ચાલુ રાખી છે. સંપર્કમાં રહેવા, અથવા બિઝનેસ કન્સલ્ટન્ટ સાથે વાત કરવા 311 નંબર પર કોલ કરો અથવા covid19business@brampton.ca ને ઈમેઇલ મોકલો.

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ ગુડ ફાઇવ પર કેટલાક રૂટ રદ કરીને ઘટાડેલા રવિવારના સમયપત્રક પર, અને ઈસ્ટર મન્ડે પર વધારે સારી રવિવારની સર્વિસ (વ્યસ્ત રૂટ્સ પર સવાર અને બપોરના વ્યસ્ત સમય દરમિયાન વધારેલી ટ્રિપ્સ સાથે રવિવારની નિયમિત સર્વિસ) કાર્યરત રહેશે. ગુડ ફાઇવ પર અમારા ટર્મિનલ્સ પરના કસ્ટમર સર્વિસ કાઉન્ટર્સ બંધ રહેશે.



BRAMPTON

Service and Information Update

COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં અને બ્રેમ્પટન ટ્રાન્ઝિટ પોતાના સમુદાયને સુરક્ષિત રીતે સેવા આપી રહ્યું હોવાની ખાતરી કરવા, ઈસ્ટર મન્ડેથી શરૂ કરીને, કેટલાક રૂટ્સમાં ઘટાડો અને કેન્સલેશન (રદકરણ) આગળ સૂચના આપવામાં આવે નહિ ત્યાં સુધી અમલમાં રહેશે. સર્વિસમાં ફેરફારોની યાદી માટે વેબસાઈટ www.bramptontransit.com જુઓ.

વધારે સારી સફાઈ અને સ્વચ્છતા (સેનિટાઈઝિંગ) સમયપત્રક અમલમાં રહે છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટનું લક્ષ્ય તમામ સખત સપાટીઓ, ઓપરેટર કમ્પાર્ટમેન્ટ્સ અને બેઠકો સહિત, બસોને દર 48 કલાકે ચેપરહિત કરવાનું છે. બસોને હાલમાં દર 24 કલાકે સેનિટાઈઝ કરવામાં આવે છે. સખત સપાટીઓ ધરાવતી સગવડો અને ટર્મિનલ્સને રોજિંદા ધોરણે સાફ અને સેનિટાઈઝ કરવામાં આવે છે. ઉતારુઓને પ્રવાસ કરતી વખતે પોતાના અંગત ડિસઇન્ફેક્ટન્ટ (ચેપનાશક પદાર્થ), જેમ કે હેન્ડ સેનેટાઈઝર કે વાઈપ્સ સાથે રાખવા, અને પોતાના હાથ અવારનવાર ધોવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

રૂટ અને સમયપત્રક માહિતી માટે, 905.874.2999 નંબર પર ફોન કોલ કરો અથવા વેબસાઈટ www.bramptontransit.com જુઓ. રિયલ-ટાઈમ (વાસ્તવિક સમયે) આગામી બસ માહિતી મેળવવા તમારા સ્માર્ટ ફોન કે અન્ય મોબાઈલ સાધન પર વેબસાઈટ nextride.brampton.ca જુઓ. અન્ય ફેરના આયોજનને લગતા સાધનો માટે વેબસાઈટ www.triplinx.ca અથવા ગૂગલ મેપ્સ જુઓ.

બ્રેમ્પટન રિક્રિએશન

તમામ મનોરંજન કાર્યક્રમો અને સગવડો ભાડે આપવાનું આગળ સૂચના આપવામાં આવે નહિ ત્યાં સુધી રદ કરવામાં આવે છે. કેડિટ્સ આપમેળે (રિક્રિએશન પ્રોગ્રામ) એકાઉન્ટ્સમાં જમા કરવામાં આવશે. વધુ માહિતી માટે કૃપા કરી reconnects@brampton.ca ને ઈમેઈલ મોકલો.

બાળકો અને જુવાનિયાઓને ઘરમાં મનોરંજન મળી રહે તે માટે પ્રિન્ટ કાઢી શકાતી એક્ટિવિટી શીટ્સ સહિત, વિવિધ વાસ્તવિક કાર્યક્રમ વિકલ્પો (વર્ચ્યુઅલ પ્રોગ્રામિંગ ઓપ્શન) વેબસાઈટ www.brampton.ca/recreation પર ઉપલબ્ધ રહેશે.

બ્રેમ્પટન લાઈબ્રેરી

બ્રેમ્પટનની તમામ પુસ્તકાલય શાખાઓ આગળ સૂચના આપવામાં આવે નહિ ત્યાં સુધી બંધ કરવામાં આવી છે. અઠવાડિક રજાઓમાં મનોરંજન માટે, સ્ટ્રીમિંગ મૂવીસ અને મ્યુઝિક અજમાવી જુઓ, અથવા ઈબૂક વાંચો! અમારા ડિજિટલ ઉત્પાદો, કાર્યક્રમો અને સેવાઓ અંગે વધુ માહિતી માટે, વેબસાઈટ www.bramptonlibrary.ca જુઓ અથવા info@bramlib.on.ca ને ઈમેઈલ મોકલો.

બ્રેમ્પટન એનિમલ સર્વિસીસ

બ્રેમ્પટન એનિમલ શેલ્ટર ગુડ ફ્રાઈડે, રવિવાર - એપ્રિલ 12 અને ઈસ્ટર મન્ડે બંધ રહેશે. શનિવાર, એપ્રિલ 11 નાં રોજ, શેલ્ટર માત્ર એપોઈન્ટમેન્ટથી રિકલેઈમ કરવા માટે સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.

એનિમલ કંટ્રોલ (પ્રાણી નિયંત્રણ) સોમવારથી શુક્રવાર સવારે 7 થી રાત્રે 10 વાગ્યા સુધી અને શનિવારે અને રવિવારે અને રજાઓના દિવસોમાં સવારે 8 થી સાંજે 6:30 વાગ્યા સુધી રસ્તા પર રહે છે, અને માત્ર નીચેના કોલ્સને પ્રતિભાવ આપશે:

- માંદા/ઈજા પામેલા/આક્રમક ઘરેલું પ્રાણીઓ અને વન્ય જીવોને લઈ જવા
- આક્રમક પ્રાણી
- દોડીને ભાગતા કૂતરા
- કૂતરું કરડવાની તપાસ
- બંધિયાર રખડતું કૂતરું લઈ જવા
- મરેલું પ્રાણી લઈ જવા

આ સિવાયના સમયે, એનિમલ કંટ્રોલ માત્ર ઈમરજન્સીમાં પ્રતિભાવ આપશે.

-30-

मिडिया संपर्क :

मोनिका दुग्गल (Monika Duggal)

कोऑर्डिनेटर, मिडिया अन्ड कम्युनिटी एंगेजमेन्ट

व्यूडात्मक संवाद

सीटी ओफ् ब्रॅम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca